

South West (Athwa) Zone Community Halls & Party Plot Booking Form

Booking Type *	<input type="checkbox"/> Advance <input type="checkbox"/> Regular		
Hall Name *	<input type="checkbox"/> Althan Community Hall (opp. Althan Tenament) <input type="checkbox"/> S.K.Park Umra Community hall <input type="checkbox"/> Althan- Bhatar Community Hall (Nr. Soham circle) <input type="checkbox"/> Althan- Bhatar Partyplot (Nr. Soham circle) <input type="checkbox"/> Gunatit nagar Party plot <input type="checkbox"/> Rundh Magdalla Party Plot <input type="checkbox"/> Bhimrad Party Plot <input type="checkbox"/> Ramleela Medan Party Plot <input type="checkbox"/> Athwa Party Plot		
Program Type *	<input type="checkbox"/> Educational/ Samajik Sanskrutik Karyakram (શૈક્ષણિક/સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ)	<input type="checkbox"/> Religious Lectures (ધાર્મિક વચન)	<input type="checkbox"/> Seminars (સેમીનાર)
	<input type="checkbox"/> Marriage/Reception/Engagement - લગ્ન/સ્વાગત/સગાઈ	<input type="checkbox"/> Business Purpose(4 days or less) - બિઝનેસ હેતુ(૪ દિવસ અથવા ઓછા)	<input type="checkbox"/> Social/Culturer Program - સામાજિક/સાંસ્કૃતિક કાર્યક્રમ
	<input type="checkbox"/> Meeting(without Food & Breakfast) (મીટીંગ(ફૂડ એન્ડ બ્રેકફાસ્ટ વગર)	<input type="checkbox"/> Shok-Sabha(without Food & Breakfast) (શોક સભા(ફૂડ એન્ડ બ્રેકફાસ્ટ વગર)	<input type="checkbox"/> Registered working for public purposes, public trusts, associations(સાર્વજનિક હેતુઓ માટે કામ કરતા રજીસ્ટર્ડ જાહેર ટ્રસ્ટ એસોસિએશનો)
	<input type="checkbox"/> Baby Shower - સીમંતવિધિ	<input type="checkbox"/> Religious Function - ધાર્મિક કાર્યક્રમ	
Booking Date *			
Hall Floor*	<input type="checkbox"/> Ground Floor <input type="checkbox"/> First Floor		
Party Plot*	<input type="checkbox"/> Plot No.1 <input type="checkbox"/> Plot No.2		
Name of Organization / Applicant *			
	(Cheque for refund of deposit if any will be issued in above name only)		
Responsible Person *			
Identity Card No. *			
TAN			
GST No.			
Address For Communication*			
City *			
State *			
Email ID *			
Phone No. *			
Mobile Number*			
Provide Bank Details for Refund Process if any			
MICR Code*			
Bank Account Number			
IFSC Code*			

Note:

1. For booking payment must be made in cash/DD/Credit-Debit Card/Pay Order.
2. Advance booking to be considered as 151 days or more and regular booking considered within 150 days.
3. All parties/organizers have to observe the SMC RULES.
4. Filling Mandatory (*)
5. You Need to Attach the Following Documents While Applying for a Community hall Booking.
 - (1) Identity Proof Attachment (Any One) (Aadhar Card, Pan Card, Election Card, Driving Licence)
 - (2) Bank Detail Attachment (Any One) (Bank Passbook 1 st page, Cancel Cheque)

Name & Signature